

ભેંસ ભાગોળે

– ગિજુભાઈ

ગામનું એવું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામના પટેલને થયું કે, એક ભેંશ હું લઉં.

જઈને પટલાણીને કહે : “સાંભળ્યું કે ? – આપણો એક ભેંશ લેવી છે. આંગણો ભેંશ હોય તો સાંદું. છોકરાંછૈયાને દૂધ મળો; બાકી મેળવીએ અનું દહી થાય, ઘી થાય; ને છાશ થાય તે આડોશીપાડોશીને અપાય.”

પટલાણી કહે : “એ બધું ઠીક, પણ જાડી રેડ જેવી છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.”

“તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં ? એમ છાશ નહિ અપાય.” પટલાણી કહે : “નહિ કેમ અપાય ? અપાશે ! ઘર તો મારું ય છે ને ? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ મારાં પિયરિયાંને !”

પટેલ કહે : “છે તંભો !”

પટલાણી કહે : “તમારાંને આપો !”

આમ કરતાં વાત વધી પડીને પટેલ-પટલાણી લડી પડ્યાં !


એક તો પટેલ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી જ નાખ્યાં ! ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશીપાડોશી દોડી આવ્યાં.

“છે શું, પટેલ ? આ શું માંડયું છે ?”

પટલાણી કહે : “જુઓ તો બાપુ – આ વાંસામાં સોળ ઊદ્ધ્યા છે તે ! પટેલને કાંઈ હાથ છે !”

પટેલ કહે : “તો કો’કની જીભ ચાલે, ને કો’કનો હાથ ચાલે !”

“પણ છે શું ? કજિયો શાનો છે ?”



“‘એ તો છાશનો છે. પટેલ કે’ છે કે, છાશ તારાં પિયરિયાંને નહિ ! તે નહિ શું કામ ? દૂધ ભલે ને એનાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ ? એ મારે નહિ ચાલે !’’

ત્યાં તો પાછા પટેલ બિજાયા ને પરોણી લઈને દોડ્યા.

પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યુ : “‘અરે, આ બેંશ તો ભાગોળે છે, ને આ ઘમરોળ શાના ?’’

વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે : “‘પટેલ, પટેલ ! વઢવાડ શું કરો છો ? આ તમારી બેંશ શિંગારું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! ઢોર રજણતાં મૂકતાં શરમાતા નથી ?’’

પટેલ કહે : “‘બેંશ વળી કોને હતી ?’’

વાણિયો કહે : “‘બેંશ વળી કોને હતી ?’’

વાણિયો કહે : “‘ત્યારે કઈ બેંશની છાશ સારુ લડો છો ?’’

પટેલ—પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં કામે લાગ્યાં.

